SHIVANSH FINSERVE LIMITED

(FORMERELY KNOWN AS MANSAROVAR FINANCIAL SERVICES LIMITED)

CIN:- L65100GJ1984PLC082579

Date: 07.09.2022

To
The Department of Corporate Affairs,
Bombay Stock Exchange Limited,
P J Towers, Dalal Street
Mumbai

SUB: NEWSPAPER ADVERTISEMENT FOR ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE

Ref.: BSE Script code:-539593

Dear Sir,

With respect to captioned subject, the company hereby informed you that the company has published in the Newspaper NOTICE OF ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE as per regulation 47 of SEBI (LODR), 2015. And the copies of the Newspaper Advertisement are attached herewith.

Kindly acknowledge the same & take on your records.

Thanking You.

Yours Faithfully

FOR, SHIVANSH FINSERVE LIMITED

DIRCTOR JIGNESH SHAH

DIN: 02112343

PURPLE ENTERTAINMENT LIMITED

CIN: L65100GJ1974PLC084389

Registered Office: 30-B, THIRD FLOOR, AJANTA COMPLEX, INCOME TAX

BOOK CLOSURE

PURPLE ENTERTAINMENT LIMITED will be held on Tuesday,

27th September, 2022 at 03:00 p.m. at registered office of the

company to transact the ordinary and special business, as set

applicable provision of the Companies Act, 2013 and the rules

made thereunder, the Notice together with Annual Report for the

Financial Year 2021-22 has been sent to Members. The Notice

of the AGM together with Annual Report is also available on the

company's website: https://purple-entertainment.co.in/

Members who have not received the Notice and Annual Report

may refer or download the same from the website of the

company or may request for a soft copy of the same by writing to

the company by Email on purpleentertainments7@gmail.com or

given that pursuant to section 91 of the Companies Act, 2013

read with the Companies (Management and Administration)

Rules, 2014 the register of members and share transfer books of

the company will remained closed from 20.09.2022 to

27.09.2022 (both days inclusive) for the purpose of ensuing

annual general meeting of the company to be held on 27th

Notice of BOOK CLOSURE PERIOD: Notice is hereby

out in the Notice of the said meeting.

at the registered office of the company.

FOR, PURPLE ENTERTAINMENT LIMITED

CHIRAG KIRTIKUMAR SHAH

Notice is hereby given that the annual general meeting of

Notice of Annual report and AGM: In compliance with the

CHANGE OF NAME

I Have Changed My Old

Name MANOJKUMAR INDRASINH ZALA To New

MANOJSINH INDRASINH

Add:- At- Jethajina Muvada

Po-Antroli Ta.Talod,

Di. Sabarkantha

TENDER NOTICE 05-2022

MANDAL, BECHARAJI SPECIAL INVESTMENT REGIONAL

DEVELOPMENT AUTHORITY, (MBSIRDA)

<u>BLOCK NO-11,12, THIRD FLOOR, UDHYOG BHAVAN, GANDHINAGAR</u>

ONLINE BID ARE INVITED FOR ENGAGEMENT OF AN AGENCY FOR SURVEY WORK, MAPNI, MELVANI AND CERTIFICATION FROM D.I.L.R. OFFICE AND DEMARCATION OF FINAL PLOT IN MANDAL BECHARAJI SPECIAL INVESTMENT REGION (MBSIR).

ONLINE TENDER AND OTHER DETAILS WILL BE AVAILABLE ON

WEBSITE www.nprocure.com FROM dt. 06-09-2022. THE LAST DATE FOR ONLINE SUBMISSON OF TECHNICAL BID AND

FINANCIAL BID IS 23-09-2022 UPTO 6.00 P.M. AND LAST DATE FOR

PHYSICAL SUBMISSION OF TENDER BID AT OUR OFFICE

CHANGE OF NAME

Ahmedabad-382480

I Have Changed My Old Name **PATEL ARVINDKUMAR PARSOTTAMBHAI** To New

PATEL ARVINDBHAI PARSOTTAMBHAI. Add:- B-99, Someshwar Tenament, Nr. Ambika Cross Road, Ranip, Ahmedabad-382480 2407

CHANGE OF NAME

I Have Changed My Old Name **PATEL VIDHI ARVINDKUMAR** To New

PATEL VIDHI ARVINDBHAI. Add:- B-99, Someshwar Tenament, Nr. Ambika Cross Road, Ranip, Ahmedabad-382480

CHANGE OF NAME

I Have Changed My Old Name SHWETA PARAS GHIYA To New Name SWETA PARAS GHIYA. Add: - 902, Prabhat Complex Race Course, Rajkot 2409

CHANGE OF NAME

I Have Changed My Old Name **NOORANI ZEBA** MOHAMMEDNAEEM To New Name

MEMON ZEBA MOHMMADNAEEM. Add:- 1, Geeta Bharti Society, Danilimda Ahmedabad

CHANGE OF NAME

I Have Changed My Old Name **SNEHAKUMARI** RAMESHCHANDRA **CHRISTIAN** To New Name CHRISTIAN SNEHA SATISH. Add:- Flat No-2, Raviraj Apartment, B/h Hiren Chambers, Nr. Prakash Petrol Pump Saraspur, Ahmedabad 2411

CHANGE OF NAME

I Have Changed My Old Name RAMWANI DEVIYANI SUNILKUMAR To New Name RAMWANI DEVYANI SUNILKUMAR.

Add:- 35, Maheshwari Society, Kalol Road, Sanand Ahmedabad-382110 A002

CHANGE OF NAME

I Have Changed My Old Name **PRAJAPATI** JALPABEN SHAILESHBHAI To New Name PRAJAPATI JALPA TEJASKUMAR. Add:- A-67. Shree Rang Kuti

Bunglows, Bholav, Zadeshwar Road, Bharuch-3892015

V033

CHANGE OF NAME

I Have Changed My Old Name **JAYNABEN VIMAL** KAKADIYA To New Name JAYNA VIMAL KAKADIYA Add:- F-501, Shri Balaii Enclave Opp. Shri Ram Vatika, Naroda, Ahmedabad

WESTERN RAILWAY

MISCELLANEOUS ELECTRIFICATION WORKS

E-TENDER NOTICE No.: EL/C/ADI/ GS/257/2022-23/R1. Name of Work with its Location : Miscellaneous Electrification Work of Service Buildings, LC Gates, Platforms, Cover Sheds, Staff Quarters and Proving AC unit in Relay Rooms of Surendranagar-Rajkot Section in Connection with Doubling of Broad Gauge Single Line Section. Approx. Cost of Work : ₹ 99,84,839/-. EMD : ₹ 1,99,700/-. Date and Time of Submission and Opening of Bid As Specified on IREPS Portal Website particular and Notice Board Where Details of Tender can be Seen & Address of the office: www.ireps.gov.in Notice Board and Office of the Dy. Chief Electrical Engineer (Construction), 'C' Wing, Nirman Bhavan - Asarva

Western Railway, Ahmedabad (Gujarat-382 345) Follow us on: twitter.com/WesternRly

ESTERN RAILWAY - VADODARA DIVISION

PROVIDING COVER SHED OVER PLATFORMS e-TENDER NOTICE NO. DRM-BRC 065 OF 2022-23

Sealed Tenders for and on behalf of the President of India are invited by Divisiona Railway Manager (W A/C.) Western Railway, Pratapnagar, Vadodara-390 004 No. <u>DRM BRC 065 of 2022-23.</u> Name o Work: Vadodara Division :- Providing cover shed over Platforms at Bharuch, Ankleshwar, Kim, Kosamba, Palej and Miyagam Railway station. For Balance Quantity. Approximate Cost of work (in ₹): 8,77,60,746.96 Bid Security to be deposited (in ₹): 5,88,800.00. Date and time for submission of tender and opening of tender: Tender is to be submitted on 23-09-2022 before 15:00 Hrs. and is to be opened on same date a 15:30 Hrs. Website particulars and notice for location where complete details can be seen & Address of the office from where the tender form car be purchased: Website @ www.ireps.gov.in Divisional Railway Manager (W A/C), Western Railway, Pratapnagar, Vadodara-4.

Like us on: f facebook.com/WesternRlv

Moody's retains India's sovereign credit ratings Mumbai, Sep 6 (IANS) "The stable outlook reand weak debt affordability tions, supported by the effective implementation of

The impact of the Russia-Ukraine conflict, higher inflation and tightening global financial conditions on the back of policy tightening, is unlikely to derail India's ongoing recovery from the pandemic in 2022 and 2023, Moody's said in a release on Tuesday.

As per the release, India's sovereign ratings has been retained by Moody's at Baa3 with a stable outlook.

flects our view that the risks from negative feedback between the economy and financial system are receding. "With higher capital buffers and greater liquidity, banks and nonbank financial institutions (NBFIs) pose much less risk to the sovereign than we previously anticipated, facilitating the ongoing recovery from the pandemic.While risks stemming from a high debt burden

remain, we expect that the economic environment will allow for a gradual narrowing in the general government fiscal deficit over the next few years, avoiding further deterioration in the sovereign credit profile," the release said. The release also said that the ratings agency could upgrade the rating if India's economic growth potential increased materially beyond their expecta-

fective implementation of economic and financial sector reforms that led to a significant and sustained pickup in the private sector investment. "Effective implementation of fiscal policy measures that resulted in a sustained decline in the government's debt burden and improvements in debt affordability would also support the credit profile," release added.

CHANGE OF NAME I Have Changed My Old Name PATEL PANKESHKUMAR SANKALCHAND To New Name

PATEL PANKAJKUMAR SANKALCHAND. Add:- C/303. Kalrav Residency, Nanachiloda, Ahmedabad

Loss Of ID Card

HDFC Bank ID Card# 220309823900058 of

Mahesh Ganpatbhai Parmar (FOS Shah & Jhaveri Associates) has been lost Nr. Maya Cinema Road, Kubernagar **on 05-09-2022.**

Whoever find please contact

on Mobile# 8320291492

THEREOF.

DT.: 06-09-2022 PLACE : GANDHINAGAR INF/1292/22-23

ADDRESS IS **26-09-2022** UPTO 05.00 P.M.

FOR ANY CHANGE MBSIRDA RESERVE THE RIGHT TO REJECT ANY OR ALL OFFERS RECEIVED WITHOUT ASSIGNING REASON

CHIEF EXECUTIVE OFFICER

CHANGE OF NAME

I Have Changed My Old Name **DIPTI GHANSHYAM**

PATEL To New Name

MARIYAM SAJID

RANGINWALA.

Add:- AT- 19 Th 4 Th Floor

DadaBhai Navroji Flat,

Khanpur Ahmedabad.

MADHYA PRADESH TODAY MEDIA LIMITED Registered office: Plot No.5, Press Complex, Zone - I, M. P. Nagar, Bhopal - 462 011 Website: www.pradeshtoday.com Email Id: cs@pradeshtoday.org, Phone: 0755-30955555, 3095500, 7185600 CIN: L22120MP2010PLC024758

NOTICE

- NOTICE is hereby given that the 12th Annual General Meeting (AGM) of the Company will be held on Friday, September 30, 2022 at 02:00 P.M. through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), to transact the businesses as set out in the Notice convening the said Meeting and the Explanatory Statement thereto, in compliance with the provisions of the Companies Act, 2013 (the Act) and Rules framed thereunder read with General Circulars No. 2/2022 dated May 50.22 and related General Circulars issued by the Ministry of Corporate Affairs (MCA) from time to time as well as Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13 2022 issued by the Securities and Exchange Board of India(SEBI) along with any other applicable Circulars issued by MCA and/or SEBI in this regard Members will be able to attend and participate in the ensuing AGM through audio visual means and the facility of appointment of proxy will not be available. Members attending the AGM through audio visual means will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.
- 2. Electronic copies of the Notice of AGM and Annual Report for the financial year ended on 31st March, 2022 will be sent in electronic form to all those Members whose email addresses are registered with the Company's Registrar and Share Transfer Agent/ Depository Participants, in compliance with the said circulars. The aforementioned documents will also available on the website of the Company www.pradeshtoday.com and on the website of the Stock Exchange at www.nseindia.com. Members are requested to note that the physical copies of the aforesaid documents will not be made available to them by the Company as per the provisions of the Circulars.
- The Company is pleased to provide remote e-voting facility to the Members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said Meeting. The facility of e-voting will also be made available at the AGM and Members attending the AGM through audio visual means, who have not cast their vote by remote e-voting, will be able to vote at the AGM. The Company has availed the services of CDSL to provide the facility of remote e-voting/ Members of the Company holding shares in physical form or who have not registered/ updated their e-mail addresses with the Company / Depositories, are requested to send the following documents/ information via e-mail to cs@pradeshtoday.org/info@bigshareonline.com in order to register/ update their e-mail addresses and to obtain user id & password to cast their vote through remote e-voting or e-voting at the AGM:
- Name registered in the records of the Company;
 Dp Id & Client Id, Client Master Copy or Consolidated Account Statement (For shares held in demat form);
 Folio No., Share Certificate (For shares held in physical form);
 E-mail id and mobile number;
- E-mail is and mobile number;
 Self-attested scanned copies of PAN & Aadhaar.
 The detailed instructions for joining the AGM through audio visual means and casting the vote through remote e-voting / e-voting at the AGM are provided in the Notice of the AGM. Members are requested to carefully go through the same.
- NOTICE is also hereby given that pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013 and the Rules made thereunder, the Register of Members and the Share Transfer Books of the Company shall remain closed from Saturday the September 24 2022 to Friday the September 30 2022 (both days inclusive), for the purpose of determining the eligibility of the Members entitled to vote by electronic means or at the AGM.

For BY ORDER OF THE BOARD
MADHYA PRADESH TODAY MEDIA LIMITED

CHAIRMAN CUM MANAGING DIRECTOR

: 07th SEPTEMBER, 2022 : BHOPAL

HRADAYESH KUMAR DIXIT

AMRAPALI CAPITAL AND FINANCE SERVICES LIMITED CIN: L65910GJ1994PLC118992

Reg.Office: Unit No. PO5-02E, 5th Floor, Tower A WTC Gift City, Gandhinagar-382355 Corporate office: 19,20,21 Narayan Chambers, 3rd Floor, Behind Patang Hotel, Ashram Road Ahmedabad-380009 Contact No.+917926581329, E-mail ID:grievances@amrapali.com, Website: www.amrapali.com.

NOTICE OF THE 28THANNUAL GENERAL MEETING OF THE COMPANY AND E-VOTING

NOTICE is hereby given that in view of the continuing Covid-19 pandemic and in accordance with the May 5, 2020 Circular No. 02/2022read with Circular no 2022/02 dated May 05, 2022, with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020 and Circularno. 02/2021 dated January 13, 2021 in relation to "Clarification on holding of annual general meeting (AGM) throughvideo conferencing (VC) or other audio visual means (OAVM)" (hereinafter collectively referred to as "MCA Circulars") issued by Ministry of Corporate Affairs ("MCA") for holding of Annual General Meeting through VC or OAVM, the Twenty Eighth 28th) Annual General Meeting (AGM) of the Members of Amrapali Capital and Finance Services Limitedbe held on Thursday, September 29, 2022 at 04:00 P.M. through Video Conferencing ("VC") / Other Audic Visual Means ("OAVM") to transact the Ordinary Businesses and Special Businesses as set out in the notice of 28th AGM.

In accordance with the General Circular No. 02/2022 dated May 05, 2022 read with General Circular No. 14/2020 dated April 8, 2020, General Circular No. 17/2020 dated April 13, 2020 and General Circular No. 02/2021 dated January 13,2021, issued by the Ministry of Corporate Affairs and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12,2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 issued by the Securities ExchangeBoard of India (SEBI)the Notice of AGM along with Annual Report 2021-22have been sent through electronic mode only to those Members whose email addresses are registered with the Company/ Depositories. Member may note that Notice and Annual Report 2021-22have been uploaded on the website of the Company at www.amrapali.com,websiteof Bombay Stock Exchange of India Limited at www.bseindia.com and website of National Securities Depository Limited (NSDL)i.e. www.evoting.nsdl.com.

In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in Demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the notice of 28thAGM and Annual Report 2021-22 could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:

1. In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back). PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email to grievances@amrapali.com. 2 .In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (selfattested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to grievances@amrapali.com. 3. Alternatively member may send an e-mail request to evoting@nsdl.co.infor obtaining User ID and

Password by proving the details mentioned in Point (1) or (2) as the case may be. Post successful registration of the e-mail address, the shareholder would get soft copies of notice of

28thAGM and Annual Report 2021-22 and the procedure for e-voting along with the user-id and the password to enable e-voting for 28thAGM. In case of any queries, shareholder may write to the Company at grievances@amrapali.comShareholders are requested to register/ update their Email Ids with their Depository Participant(s) with whom they maintain their demat accounts if shares are held in dematerialized mode by submitting the requisite documents.

There being physical shareholders in the Company, the Register of members and share transfer books of the Company will be closed from Thursday, September 22, 2022 to Thursday, September 29, 2022. Members whose names are recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as onThursday, September 22, 2022 ("Cut-off date"), shall only be entitled to avail the facility of remote e-voting as well as e-voting on the Annual General Meeting.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rules made thereunder (as amended) and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 (as amended) and above mentioned MCA Circulars, the Company is providing facility of remote e-voting and evoting on the date of the AGM to its Members in respect of the businesses to be transacted at the AGM. For this purpose, the Company has entered into an agreement with NSDL for facilitating

voting through electronic means. The remote e-voting will commence on 9:00 A.M. on Monday, September 26, 2022 and will end on 5:00 P.M. on Wednesday, September 28, 2022. During this period, the members of the Company holding shares as on Cut-off date may cast their vote electronically (Remote E-Voting). Members may note that a) the remote e-voting module shall be disabled by NSDLafter the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently; b) the facility of e-voting shall be made available at the 28thAGM,and c) the members who have cast their vote by remote e-voting prior to the 28thAGM

may also attend the 28thAGM but shall not be entitled to cast their vote again. Detailed procedure for remote e-voting/ e-voting is provided in the Notice of the 28thAnnual General Meeting. Any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as on the cut-off date i.e. Thursday, September 22, 2022, are requested to refer to the Notice of AGM for the process to be adopted for obtaining the USER ID and Password for casting the vote.

In case of any queries for e-voting, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-222-990 or send a request at evoting@nsdl.co.in.Members may also contact Ms.RushikaTejrajji Parekh, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to www.amrapali.comor may call on +91- 7926581329for any further clarification.

Members can attend and participate in the Annual General Meeting through VC/OAVM facility. The instructions for joining the Annual General Meeting through VC/OAVM are provided in the Notice of the Annual General Meeting. In case the shareholders/members have any queries or issues regarding participation in the AGM, you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990. Members attending the meeting through VC/OAVM shall be counted for the purposes of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013.

> For, AMRAPALI CAPITAL AND FINANCE SERVICES LTD.

Alkesh Dashrathlal Patel **Chairman & Managing Director**

Ahmedabad, Page 7

ASHRAM ROAD, AHMEDABAD 380009 Gujarat Email Id: purple-entertainments7@gmail.com https://purple-entertainment.co.in/ Email Id: shivanshfinserve@gmail.com **NOTICE OF ANNUAL GENERAL MEETING,**

Sd/-

DIRECTOR

CIN: L65100GJ1984PLC082579 Registered Office: 22First Floor, Harsidhh Complex, Opp. Kalupur Commerical Bank, Income Tax, Ashram Road, Ahmedabad 380014 Gujarat

SHIVANSH FINSERVE LIMITED

NOTICE OF ANNUAL GENERAL MEETING AND BOOK CLOSURE

Notice is hereby given that the annual general meeting of SHIVANSH FINSERVE LIMITED will be held on Thursday, 29th September, 2022 at 01:00 p.m. at registered office of the company to transact the ordinary and special business, as set out in the Notice of the said meeting.

Notice of Annual report and AGM: In compliance with the applicable provision of the Companies Act, 2013 and the rules made thereunder, the Notice together with Annual Report for the Financial Year 2021-22 has been sent to Members. The Notice of the AGM together with Annual Report is also available on the company's website: www.shivanshfinserve.com. Members who have not received the Notice and Annual Report, may refer or download the same from the website of the company or may request for a soft copy of the same by writing to the company by Email ID: shivanshfinserve@gmail.com or at the registered office of the company.

Notice of BOOK CLOSURE PERIOD: Notice is hereby given that pursuant to section 91 of the Companies Act, 2013 read with the Companies (Management and Administration) Rules, 2014 the register of members and share transfer books of the company will remained closed from 22.09.2022 to 29.09.2022 (both days inclusive) for the purpose of ensuing annual general meeting of the company to be held on 29th September, 2022.

FOR, SHIVANSH FINSERVE LIMITED Sd/-

DIRECTOR JIGNESH SHAH DIN: 02112343

JAYATMA INDUSTRIES LIMITED

CIN: L17110GJ1983PLC006462 Regd. Office: 4th Floor, 1 Laxminagar, B/s Naranpura Post office Naranpura, Ahmedabad - 380013 Phone No.: 079 - 27682700 Email ID: cs@jayatma.com Website: www.jayatmaindustries.com Notice to the Shareholders of

38th Annual General Meeting NOTICE IS HEREBY GIVEN THAT THE 38th ANNUAL GENERAL MEETING (AGM) of the members of the Company will be held on Thursday, 29th September, 2022 at 12:00 PM through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM which is being circulated for convening the AGM.

In view of the persisting COVID-19 pandemic situation, social distancing norms and pursuant to General Circular Nos. 14/2020, 17/2020, 20/2020 02/2021, 19/2021, 21/2021 and 02/2022 dated 8th April 2020, 13th April 2020, 5th May 2020, 13th January 2021, 8th December 2021, 14th December 2021 and 5th May, 2022, respectively issued by the Ministry of Corporate Affairs ('MCA') (collectively referred to as 'MCA Circulars'), and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 and SEBI/HO/CFD/ CMD2/CIR/P/2022/62 dated 12th May, 2020, 15th January, 2021 and 13th May, 2022 respectively issued by the Securities and Exchange Board of India (collectively referred to as 'SEBI Circulars'), holding of the Annual General Meeting ('AGM') through Video Conferencing/ Other Audio-Visual Means ("VC/ OAVM"), without the physical presence of the Members, is permitted.

Pursuant to Provision of Section 91 of the Companies Act, 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the register of members and Share Transfer books of the company shall remain closed from 23rd September, 2022 to 29th September, 2022(Both days inclusive).

In accordance with the aforesaid circulars, Notice of the AGM along with Annual Report 2021-22 is being sent only by Electronic mode to those members whose Email addresses are registered with the Company/Depositories. Members may note that the Annual Report of 2021-22 is made available on Company's website: www.jayatmaindustries.com, website of Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and Annual Report 2021-22 will also be made available on website of CDSL (agency for providing remote e-voting facility) i.e. **www.evotingindia.com**. Members can attend and Participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies

REMOTE E-VOTING:

In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means on all the businesses set forth in the Notice through the remote e-Voting Services provided by CDSL. The detailed instructions for remote evoting facility are contained in the Notice which has been sent to the

The details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder:

1. Cut-off date for the purpose of remote e-voting is 22nd September

2. Period of e-voting: E-voting starts from 9:00 a.m. on 26th September, 2022 and ends at 5:00 p.m. on 28th September, 2022. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date.

3. Persons who have acquired shares and become member of the

Company after dispatch of Annual Report 2021-22 and holding shares as on the cut-off date i.e. 22nd September, 2022, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice. 4. Annual Report 2021-22 is available on website of the Company (www.jayatmaindustries.com), website of Stock Exchange i.e. BSÉ

Limited (www.bseindia.com) and Annual Report 2021-22 will also be made available on website of CDSL (agency for providing remote e voting facility) (i.e. www.evotingindia.com) 5. A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories

as on cut-off date only, shall be entitle to avail the facility of remote evoting as well as voting in the AGM. 6. Members attending AGM through VC/OAVM facility, who have not casted their votes by remote e-voting shall be able to cast their votes

7. Members who have casted their votes by remote e-voting, may also attend the AGM through VC/OAVM facility but shall not be entitled the AGM through VC/OAVM facility but shall not be entitled to the AGM through VC/OAVM facility but shall not be e to cast their votes again at the AGM.

through e-voting at the AGM.

Place: AHMEDABAD

Date: 30th August, 2022

8. In case of any query relating to e-voting, members/beneficial owners may refer the frequently asked questions and e-voting user manual available at the download section of www.evotingindia.com or call on toll free no.: 1800-22-5533 or send a request at helpdesk.evoting@cdslindia.com

9. In case members have not registered their email addresses with

the Company/Depository, please follow the below instructions to register email address for obtaining login details for e-voting. a. For members holding shares in physical mode - Please provide necessary details like Folio No., Name of Shareholder by email to support@purvashare.com or cs@jayatma.com.

Members holding shares in demat mode can get their email ID registered by contacting their respective depository participant or by email to support@purvashare.com or cs@jayatma.com. By order of the Board

> Nirav Shah CEO &Director (DIN-00397336)

For, Jayatma Industries Limited

DIN: 08111288

JAYATMA ENTERPRISES LIMITED CIN: L17110GJ1979PLC003355 Regd. Office: 2nd Floor, 1 Laxminagar, B/s Naranpura post office, Naranpura, Ahmedabad - 380013 **Phone No.:** 079 - 27682700 Email ID: cs@jayatma.com Website: www.jayatmaenterprises.com Notice to the Shareholders of

42nd Annual General Meeting NOTICE IS HEREBY GIVEN THAT THE 42nd ANNUAL GENERAL MEETING (AGM) of the members of the Company will be held on Thursday, 29th September, 2022 at 11:00 A.M. through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM which is being circulated for convening the AGM.

In view of the persisting COVID-19 pandemic situation, social distancing norms and pursuant to General Circular Nos. 14/2020, 17/2020, 20/2020 02/2021, 19/2021, 21/2021 and 02/2022 dated 8th April 2020, 13th April 2020, 5th May 2020, 13th January 2021, 8th December 2021, 14th December 2021 and 5th May, 2022, respectively issued by the Ministry of Corporate Affairs ('MCA') (collectively referred to as 'MCA Circulars'), and Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/ P/2020/79, SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 and SEBI/HO/CFD/ CMD2/CIR/P/2022/62 dated 12th May, 2020, 15th January, 2021 and 13th May, 2022 respectively issued by the Securities and Exchange Board of India (collectively referred to as 'SEBI Circulars'), holding of the Annual General Meeting ('AGM') through Video Conferencing/ Other Audio-Visual Means ("VC/ OAVM"), without the physical presence of the Members, is permitted.

Pursuant to Provision of Section 91 of the Companies Act. 2013 and as per provisions of Regulation 42 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the register of members and Share Transfer books of the company shall remain closed from 23rd September, 2022 to

29th September, 2022(Both days inclusive). In accordance with the aforesaid circulars, Notice of the AGM along with Annual Report 2021-22 is being sent only by Electronic mode to those members whose Email addresses are registered with the Company/Depositories. Members may note that the Annual Report of 2021-22 is made available on Company's website: www.jayatmaenterprises.com, website of Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and Annual Report 2021-22 will also be made available on website of CDSL (agency for providing remote e-voting facility) i.e. **www.evotingindia.com** Members can attend and Participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the Notice. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies

REMOTE E-VOTING:

In compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Amendment Rules, 2015 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is providing its members, the facility to exercise their right to vote at the Annual General Meeting (AGM) by electronic means on all the businesses set forth in the Notice through the remote e-Voting Services provided by CDSL. The detailed instructions for remote evoting facility are contained in the Notice which has been sent to the

The details pursuant to the provisions of Companies Act, 2013 and Rules are given hereunder

Cut-off date for the purpose of remote e-voting is 22nd September, 2022.

Period of e-voting: E-voting starts from 9:00 a.m. on 26th September, 2022 and ends at 5:00 p.m. on 28th September 2022. Please note that remote e-voting will not be allowed beyond the above mentioned time and date.

Persons who have acquired shares and become member of the Company after dispatch of Annual Report 2021-22 and holding shares as on the cut-off date i.e. 22nd September, 2022, may cast their votes by following the instructions and process of remoti e-voting as provided in the Notice.

Annual Report 2021-22 is available on website of the Company (www.jayatmaenterprises.com), website of Stock Exchange i.e. BSE Limited (www.bseindia.com) and Annual Report 2021-22 will also be made available on website of CDSL (agency for providing remote e-voting facility) (i.e. www.evotingindia.com)

A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial owners maintained by the depositories as on cut-off date only, shall be entitle to avail the facility of remote e-voting as well as voting in the AGM. Members attending AGM through VC/OAVM facility, who have

not casted their votes by remote e-voting shall be able to cast

Members who have casted their votes by remote e-voting, may also attend the AGM through VC/OAVM facility but shall not be entitled to cast their votes again at the AGM. In case of any query relating to e-voting, members/beneficial

their votes through e-voting at the AGM.

Place : AHMEDABAD

Date :30th August, 2022

owners may refer the frequently asked questions and e-voting user manual available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800-22-5533 or send a request at helpdesk.evoting@cdslindia.com In case members have not registered their email addresses with the Company/Depository, please follow the below instructions to register email address for obtaining login details for e-voting.

Members holding shares in demat mode can get their email ID registered by contacting their respective depository participant or by email to support@purvashare.com or cs@jayatma.com.

> SD/ **Nirav Shah** Chairman & Managing Director

(DIN-00397336)

Date : 06-09-2022

Place: Gandhinagar

For members holding shares in physical mode - Please provide necessary details like Folio No., Name of Shareholder email to support@purvashare.com or cs@jayatma.com.

> By order of the Board For, Jayatma Enterprises Limited





તાઈવાનની સુરક્ષા ભારત માટે મહત્ત્વની

અમેરિકી નૌસેના પ્રમુખ માઇકલ ગિલ્ડે હાલમાં કહ્યું કે ભારતે ચીન સમક્ષ બે મોરચે પડકારો પેદા કર્યા છે. તેમના અનુસાર ભારતે ચીનને દક્ષિણ ચીન સાગરથી પૂર્વ તરફ જોવા માટે મજબૂર કર્યું છે, બલ્કે તેને સંદેશ પણ આપ્યો છે કે ભારત તરફથી જડબાતોડ જવાબ મળશે. એવી પરિસ્થિતિને જોતાં તાઇવાન પર ચીની હુમલાનો ખતરો પહેલાં કરતાં ક્ચાંય વધી ગયો છે. અમેરિકી સૈન્ય પ્રતિષ્ઠાનના એક વરિષ્ઠ અધિકારીએ ગયા વર્ષે અમેરિકી સંસદને જણાવ્યું હતું કે ૨૦૨૭ સુધી ચીન તાઇવાન પર હુમલો કરી શકે છે. પરંતુ અમેરિકી ગુપ્તચર વિભાગને હવે લાગે છે કે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેના પહેલાં જ એવો દાવ ચાલશે. તેને આશંકા છે કે આ વર્ષે નવેમ્બરમાં ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસ અને ૨૦૨૪માં આગામી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી વચ્ચે ક્યારેય પણ એવું થઈ શકે છે. એટલે કે જો બાઇડનના કાર્યકાળમાં જ ચીન એવું દુસ્સાહસ કરી શકે છે. અફઘાનિસ્તાનમાં એક આતંકી સંગઠન આગળ સમર્પણ અને પછી યુક્રેનને રશિયાના હુમલાથી બચાવવામાં બાઇડનની નિષ્ફળતા અને આ યુદ્દેઘમાં પડવાને કારણે અમેરિકાની સ્થિતિ કમજોર થઈ ગઈ છે. સાથે જ રશિયન સેનાઓને પીછેહઠ કરવા મજબુર કરવાના હેતુથી રશિયા પર લગાવવામાં આવેલા પશ્ચિમી આર્થિક પ્રતિબેંધોની અસફળતા પણ તાઇવાન પર સકંજો કસવા સાથે જોડાયેલ જિનપિંગની દાનત વધારી રહ્યું છે. તાઇવાનનો કિલ્લો તૂટવો એશિયામાં ચીની આક્રમકતાને નવી ધાર આપશે. તેનાથી હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શક્તિ સંતુલન બગડશે. કેટલાય દેશોના લશ્કરી પડકારો વધી જશે. વિશેષ કરીને જાપાન માટે, જેના નેતાઓને લાગે છે કે તાઇવાન બાદ ચીનનું આગામી નિશાન તેનો ઓકિનાવા પ્રાંત હોઇ શકે છે. ચીનની આવી ઑક્રમકતા ભારતની સુરક્ષા માટે પણ શુભ સંકેત નથી. એશિયામાં ચીનની જે સૌથી મોટા હિસ્સા પર દાનત ખરાબ છે, તે ભારતનું અરુણાચલ પ્રદેશ છે. અરુણાચલ તાઇવાનથી ત્રણ ગણું મોટું છે. ચીન પહેલેથી જ તેને પોતાના નક્શામાં દેખાડતું આવ્યું છે. ગયા વર્ષે જ્યારે બેજિંગે ભારતીય વિસ્તારોનું પોતાના હિસાર્બે નામકરણ કર્યું તો ભારતના વિદેશ મંત્રાલયે તેને હાસ્યાસ્પદ ગણાવતાં તેને એવી હરકતો બંધ કરવાનું કહ્યું. જો ચીન તાઇવાન પર કબ્જો કરી લે છે તો અરુણાચલ તેના માટે નવું તાઇવાન બની જશે. એવામાં તાઇવાનની સુરક્ષાનો મુદ્દો ભારત માર્ટે ક્યાંય વધુ મહત્ત્વનો થઈ ગયો છે.

ચીનનો કોઈપણ સૈન્ય અભ્યાસ પણ સહજ નથી થતું. ૨૦૨૦માં ચીનની સૈન્ય ટુકડીએ ભારતીય સીમાની આસપાસ જે અભ્યાસ કર્યો, તે બને દેશો વચ્ચે કેટલાય મોરચા પર ટકરાવનું બિંદુ બન્યું, જેની ચિનગારી દુર્ગમ બરફીલા હિમાલયી ક્ષેત્રમાં ભડકતી રહી. તેથી તાઇવાનની આસપાસ ચીની સૈન્ય પરીક્ષણોને હળવાશથી ન લઈ શકાય. તેમાં તેને હડપવાના જિનપિંગના ઐતિહાસિક મિશનની ઝલક મળે છે. એવી પરખમાં તાઇવાનની આર્થિક નાકાબંધી કે તેને અલગ પાડવાનું કામ કર્યું, જે દર્શાવે છે કે જિનપિંગ તાઇવાન પર એવો સકંજો કસવાની રણનીતિ અપનાવી શકે છે જેમાં આ દેશ ચીન સાથે વિલય કરવા મજબૂર થઈ જાય. આ દરમ્યાન ચીને જાપાનના ધેર્યની પણ પરીક્ષા લીધી, કોરણ કે દાગવામાં આવેલ કેટલીક મિસાઇલો જાપાની સમુદ્રી સીમાના વિશિષ્ટ્ર આર્થિક ક્ષેત્રમાં જઈને પડી. શું તાઇવાન પર ચીની આક્રમકતા ભારતની બેચેની વધારી શકે છે? યાદ રહે કે હિમાલયના ઊંચા બરફીલા પહાડો પર ચીની અને ભારતીય સૈન્ય લગભગ અઢી વર્ષથી તેનાત છે. એવી જ એક અથડામણમાં ચીને પોતાના સૈનિકો પણ ગુમાવવા પડ્યા, જે ૧૯૭૯માં વિયેતનામ હુમલા બાદ ચીની સૈનિકોના હતાહત થવાનો પહેલો કિસ્સો હતો. જોકે છેલ્લા કેટલાક સમયતી આ કડવાશ અને તનાતની કદાચ થોડી ઘટી છે, પરંતુ જરા સરખી ગફલત ભારે પડી શકે છે. તાઇવાનને લઈને જિન્પિંગે જેવી ઘેરાબંધી કરવાના પ્રયાસ કર્યા છે, તેને જોતાં આગામી મહિને ભારત-અમેરિકા સંયુક્ત સૈન્ય અભ્યાસની મહત્તા ઓર વધી ગઈ છે. બંને દેશો વચ્ચે આ પ્રસ્તાવિત અભ્યાસ હિમાલયી ક્ષેત્રમાં સમુદ્ર તળથી ૩૦૦૦ મીટરની ઊંચાઈ પર થશે. પહેલાં કોઈપણ સૈન્ય અભ્યાસના મુકાબલે ચીની સીમાની વધુ નજીક થનારો આ અભ્યાસ કદાચ બેજિંગને એવો સંદેશ આપે કે તાઇવાન સાથે યુદ્દઘ છેડવાની સ્થિતિમાં તેના માટે બીજો સંભવિત મોરચો ખુલી શકે છે. યુદ્દે અભ્યાસ, કોડનેમ વાળી આ કવાયત ચીની સીમાથી માંડ સો કિમીના દાયરામાં થવા જઈ રહી છે.

સેન્ટ ઝેવિચર્સ હાઈસ્કૂલમાં વિશ્વ જળ સપ્તાહની ઉજવણી કરવામાં આવી



(પ્રતિનિધિ)વાપી, સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં વિશ્વ જળ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. પાણી આપણા ઘરો, ખોરાક, સંસ્કૃતિ, આરોગ્ય, શિક્ષણ, અર્થશાસ્ત્ર અને આપણા કુદરતી વાતાવરણની અખંડિતતા માટે પ્રચંડ અને જટિલ મૂલ્ય ધરાવે છે. જો આપણે આમાંના કોઈપણ મૂલ્યોની અવગણના કરીએ છીએ, તો એમે આ મર્યાદિત, બદલી ન શકાય તેવા સંસાધનને ખોટી રીતે સંચાલિત કરવાનું જોખમ લઈએ છીએ. આ બાબતને ધ્યાનમાં રાખીને અને વિધાર્થીઓને જળ સંરક્ષણ અંગે જાગૃત કરવા માટે વિશ્વ જળ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ૨૫ થી ૩૦ ઓગસ્ટ - વિશ્વ જળ સપ્તાહ તરીકે ઉજવાય છે. આ સપ્તાહમાં તાજા પાણીના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરાય છે. આ સપ્તાહ માં સેંટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ વાપીમાં વક્તવ્ય, લેખન,

ચિત્રકામ અને હસ્તકલાની પ્રવૃત્તિઓ સહિતની ઘણી બધી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. આ સાથે વાપીની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલનાં સ્થાપક ડો. ઓગસ્ટિન એફ. પિન્ટોનો જન્મદિવસ ઉજવાયો હતો. સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ, વાપી દ્વારા ગત તા. ૨૯મી ઓગસ્ટ ૨૦૨૨ના રોજ સ્થાપક દિવસની ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું.જેમાં સ્થાપક અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ સભા યોજાઈહતી. ઉઉંચ્ઈ ડો. ઓગસ્ટિન એફ. પિન્ટોના જન્મદિવસની શાળામાં ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મોન્ટેસરીથી લઇ ધોરણ ૧૨ સુધીના વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ અને મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પ્રવૃત્તિઓ યુવાન ઝેવિયરાઈટ્સના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી હતી.

સૂર્યકાંત જોષી અને તેઓ ના પત્ની

ઉંસપ્ટેમ્બર રાત્રે સાડા ૯ વાગે

મંદિરમાંથી રૂા.૧.૩૬ લાખનાં ઘરેણાં ચોર ૨૪ કલાકમાં પાછાં મૂકી ગયો થયેલ ફરીયાદ મુજબ દસક્રોઈના વિસલપુર મંદીરમાં પુજારી

(એજન્સી)દસકોઈ, અમદાવાદ નજીક દસકોઈ વિસલપુર મેલડી માતાના મંદીરે રાત્રે તસ્કરોએ પુજારીના ઓશીકા પાસેથી મંદીરની ચાવી તેમજ મોબાઈલ ચોરી મંદીરનું તાળું ખોલી મંદીરમાંથી ૧૩૬૦૦૦ના ચાંદીના ઘરેણાની ચોરી કરી ૩ સપ્ટેમ્બરે ભાગી ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ ચોરને પસ્તાવો થયો હોય કે પરચો પ સપ્ટેમ્બરે બપોરે મંદીર પાછળ ઘરેણા પાછા ઘાસમાં મુકી ગયા હતા. જોકે ચોર કોણ છેઁ તે

ઓળખી શકાયું નથી.

મંદીરે તાળું મારી શેડ નીચે ખાટલામાં ઓશીકા પાસે મોબાઈલ તેમજ મંદીરની ચાવી મુકી સુઇ ગયા હતા. સવારે ૪ વાર્ગે પુજારી જાગી જતાં સમય જોવા ઓશીકા પાસે રાત્રે મુકેલ મોબાઈલ તેમજ ચાવી ગાયબ હતા. પુજારીને મોબાઈલ તેમજ ચાવી કોઈ લઈ જઈ મંદીરમાંથી ચોરી કરી ગયાની આશંકા જતા તેઓ મંદીર તરફ દોડી જઈ જોતાં મંદીરની લાઈટો બંધ અસલાલી પોલીસમાં દાખલ હતી. મુખ્યદરવાજો ખુલ્લો હતો.

નવરાત્રિમાં ચક્કવાત ખેલેચાઓના રંગમાં ભંગ પાડશે

ગુજરાતમાં ચોમાસું અંતિમ ચરણમાં છે ત્યારે હવે વરસાદ પણ ધીમે ધીમે ઘટી રહ્યો છે, જોકે આગામી ત્રણ દિવસ ગુજરાતમાં

હવામાન વિભાગે આગામી ૮ અને ૯ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. બેંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે ૮ સપ્ટેમ્બર પછી રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

આગાહી છે.

બીજી તરફ કોરોનાના કાળા કહેર બાદ ખેલૈયાઓમાં નવરાત્રિને રહ્યો છે ત્યારે હવામાનશાસ્ત્રીની હવામાનને લઇ કરવામાં આવેલી આગાહી ખેલૈયાઓની મજા અને મૂડ બગાડી શકે છે. આગામી ૨૬ સપ્ટેમ્બરથી પ ઓક્ટોબર દરમિયાન નવરાત્રિનો તહેવાર ઉત્સાહભેર રંગેચંગે ઊજવાશે ત્યારે આગાહી અનુસાર ૧૨થી ૧૭ સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે.

દથી ૮ ઓક્ટોબર દરમિયાન બંગાળની ખાડીમાં વાવાઝોડું લાવનારી સિસ્ટમ બનશે અને ૨૭થી ૫ ઓક્ટોબર દરમિયાન નાના-નાના ચક્રવાત બનશે. આ આગાહી દરમિયાન જ નવરાત્રિનો



તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે જો આગાહી ખરી ઊતરશે તો

ખેલૈયાઓની મજા બગડશે. વધુ આગાહી મુજબ રાજ્ય પર ડેમની સપાટીમાં વધારો થતાં ડેમની મળે છે.

સંભાવના છે. જો આ આગાહી સાચી પડશે તો રાજ્યમાં ચક્રવાતની આફત

આ આફત બંગાળની ખાડીમાંથી આવશે. જેથી વારંવાર ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. આ મહિનામાં જ વાવાઝોડાના ટ્રિપલ એટેકનું અનુમાન છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતના દરિયા કિનારે પવનનું જેર વધશે અને કેટલાક વિસ્તારમાં વરસાદ

બીજી તરફ ઉપરવાસમાં થયેલા

બાયડ ગામ ખાતે ગણેશ વિસર્જનનો

વધુ એક ખતરો મંડરાઈ રહ્યો છે. તે જળસપાટી ૧૩૭.૦૮ મીટર થઈ મુજબ વાવાઝોડાના ટ્રિપલ એટેકની છે.

નર્મદા ડેમની મહત્તમ જળસપાટી ૧૩૮.૬૮ મીટર છે. આગામી ૩૧ ઓક્ટોબર-રાષ્ટ્રીય એક્તાદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની મુલાકાત લે તેવી શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે ૧૭ સપ્ટેમ્બરે પીએમ મોદીને ગુજરાત રાજ્ય દ્વારા નર્મદાનાં પાણી છલોછલ ભરીને ભેટ અપાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. તે દિવસે નર્મદાનાં નીરનાં વધામણાંનો પણ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા થાય તેવી તૈયારીઓ વરસાદના કારણે સરદાર સરોવર 🛮 કરવામાં આવી રહી હોવાનું જાણવા

૮ સપ્ટેમ્બરથી ફરી વરસાદનું જોર વધશેઃ ૧૨થી ૧७ સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યભરમાં વાવાઝોડું ફૂંકાશે

પીએમ કિસાન સન્માન નિધિનો ૧૨મો હપ્તો હવે ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે

આઝાદીના અમૃત પર્વે ७૫

યશોદામાતાનું સન્માન કરાશે

શાહપુરમાં આવેલા ભાવસાર હોલ ધો.૯થી ૧૨ના પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત

૧૧ સપ્ટેમ્બરે શાહપુરના

ભાવસાર હોલ ખાતે

કાર્યક્રમ યોજાશે

અમદાવાદ,

સમગ્ર ભારતમાં ૫ સપ્ટેમ્બર

શિક્ષક દિન તરીકે ઉજવાય છે તેના

ભાગરુપે શાહપુર યુવક મંડળ દ્વારા

યશોદા સન્માન" ૧૧ સપ્ટેમ્બરને

રવિવારે સવારે ૯:૪૫ કલાકે યોજાશે

તેમ ગુજૂરાત યુનિવર્સિટીના પુર્વ

ઉપકુલપતિ તેમજ શાહપુરના અગ્રણી

ડો. જગદીશ ભાવસારે એક યાદીમાં

જણાવ્યું છે. ડો.જગદીશ ભાવસારે

કાર્યક્રમની વિગતોમાં વધુમાં જણાવ્યું

છે કે ૧૧ સપ્ટેમ્બરે ૧૮૯૩ ના દિવર્સે

અમેરિકાના શિકાગોની ધર્મ પરિષદમાં

સ્વામી વિવેકાનંદજીએ ભારતીય

સંસકૃતિનો જયજયકાર કર્યો હતો તે

વિશ્વ બંન્ધૃત્વનો દિવસ છે. આ મહાન

દિગ્વિજય દિવસ અને શિક્ષક દિવસની

ખાતે ૭૫થી વધારે

પાયાની કેળવણી

અને આરોગ્ય

જાગૃતિનું કામ

કરતી બહેનો-

કાર્યકરોનું ''માતા

ગુજરાતમાં પી એમ કિસાન સન્માન નિધિ ના ખેડૂત લાભાર્થીઓના નામ આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેંક ડીટેલ માં ભારે વિસંગતતા સામે આવતા ભારત સરકારે ગુજરાતના કૃષિ વિભાગ ને ઊભી

વિધાનસભાની ચૂંટણીઓના પગલે કિસાન સન્માન નિધિ નો ૧૨ મો હપ્તો ચૂકવવામાં આવશે તે પહેલા જ ગુજરાતમાં અંદાજિત ૮ લાખ ખેડૂતો

ઉજવણી થકી સેવાભાવથી તંદુરસ્ત

અને શિક્ષિત સામાજનિર્માણના કાર્યમાં

જોડાયેલા પાયાના કાર્યકરોને

કાર્યક્રમમાં સન્માન અપાશે. શાહપુરના

અપાશે. શાહપુર- દરિયાપુરના

અભ્યાસ સહિતના ક્ષેત્રમાં પ્રતિભાવાન

અધ્યાપકો, પી.એચ.ડી. થયેલાં અને

રમત-ગમત ક્ષેત્રે સિધ્ધી મેળવનારને

પણ આ સમારંભમાં સન્માન અપાશે.

છાત્ર-છાત્રાઓ, શિક્ષકો અને પાયાનું

કાર્ય કરતી માતા યશોદાની સન્માન

ત્રિવેણી ગુજરાત યુનિવર્સિટીના સિનિયર સિન્ડીકેટ સભ્ય, શાહપુરના

સમાજસેવી આગેવાન શ્રી કૌશિકભાઈ

જૈન, શિક્ષણવિદ્ ડો. સ્મિતા જોષી

સહિત કેળવણીક્ષેત્રના અત્રણીઓની

ઉપસ્થિતિમાં યોજાશે.

છાત્રાઓનું વિશેષ

સન્માન કરાશે

અને ૪૦ છાત્ર-

છાગાઓ નો

આશ્વાસન ઈનામ

થયેલી વિસંગતતા ખૂબ જ ઝડપથી દૂર નો કોઈ હિસાબ મળતો નથી જેના કરવાની સ્પષ્ટ સૂચના આપી છે કારણે દિલ્હીથી આ બાબતની તપાસ ઉલ્લેખનીય છે કે ગુજરાત કરવામાં આવી હતી અને તમામ કરવામાં આવી હતી અને તમામ ખેડૂતોના કેવાયસી ની કામગીરી ઝડપથી પૂરી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ નો ૧૨ મો હપ્તો હવે ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે પરંતુ ગુજરાતની અંદર એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં લાભાર્થીઓના ડેટા વેરિફિર્કેશન માં ભારે વિસંગતતા સામે આવતા રાજ્યનું કૃષિ વિભાગ દોડતું થઈ ગયું છે ઉલ્લેખની છે કે આ

કામગીરીમાં ગુજરાત દેશમાં સૌથી પાછળ હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પહેલા રાજ્યના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો ૧૨મો હપ્તો ઝડપથી મળી રહે તે માટે કવાયત શરૂ કરવામાં આવી હતી પરંતુ ભારત સરકાર ના ધ્યાને આવ્યું છે કે ગુજરાતમાં એનઆઇસી દ્વારા લાભાર્થીઓના જે ડેટા મેચ કરવામાં આવી રહ્યા છે તેમાં ભારે વિસંગતતા સામે આવી છે જેમાં ખાસ કરીને ખેડૂતોના આધાર કાર્ડ મોબાઈલ નંબર અને બેક્ર ખાતા નંબર મિસ મેચ થતા હોવાનું તેમજ કેવાયસી ની પ્રક્રિયામાં પણ ગુજરાત મંથન ગતિથી ચાલતો હોવાનું ભારત સરકારના ધ્યાને આવ્યું છે પરિષ્ણામે કેન્દ્ર સરકારે રાજ્યના કૃષિ

મંત્રી તેમના વિભાગને આ કામગીરી

ખૂબ જ ઝડપથી પૂરી કરવાના સ્પષ્ટ

ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાચો (પ્રતાિનિધિ) બાચડ, સમગ્ર રાજ્યમાં ગણેશ

ઉત્સવ ખૂબ ભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ ગામ ખાતે છેલ્લા ૨૫ વર્ષથી ગણેશ ચતુર્થી નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ગણેશ યુવક મંડળ દ્વારા બાયુડ ગામમાં ગણપતિ દાદા ની मूर्ति वां ४ते - गा४ते भव्य પંડાલમાં સ્થાપના કરાઈ હતી. અને રોજ સવાર - સાંજ પૂજા અર્ચના આરતી કરીને રાત્રે ભજન મંડળોના ભજનોનો કાર્યક્રમ ચાર દિવસ સુધી રાસ ગરબા સાથેનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે તા.૪/૯/૨૨ ના રોજૂસવારે ૧૧:૦૦ કલાકે ગણેશ વિસર્જન સમયે પંડાલમાં ગણપતિ દાદાની

આરતી ઉતારી હતી. જેમાં પૂર્વ. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિષ ભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રભારી/ પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, िष्टला मंत्री स्वामी विवे**डा**नंह ના યુવા બોર્ડના જિલ્લા સંયોજક રાહુલપુરી ગોસ્વામી, બાયડ તાલુકા સંગઠન પ્રમુખ માનસી સોઢા, નગરપાલિકા પ્રમુખ સ્નેહલભાઇ પટેલ, ઉપપ્રમુખ ગાયત્રીબેન પટેલ તેમજ્ ગર્ણેશ યુવક મંડળ ના યુવકો તથા નંગરજનો ઉપસ્થિત રહ્યા હતા



ત્યારબાદ ગણપતિદાદાની મૂર્તિને વિસર્જન માટે પંડાલ માંથી બહાર લાવી માણસાના રથમાં

ઝૂમતા બાયડ ગામ થી લઈ બાયડ હોઇસ્કુલ થઈ ગાબટ રોડ થી બાયડ બસ સ્ટેશન થઈ વાંજતે ગાજતે વાત્રક મુકામે પહોંચી હતી જયાં વાગક નદીના કિનારે ગણપત દાદા ની આરતી ઉતારી વાત્રક નદીમાં મૂર્તિને વિસર્જિત કરાઈ હતી. આ ગણેશ વિસર્જન ના

જેટલા નગર જનો મન મૂકીને

ઉત્સવ ને પરિપૂર્ણ કરવામાં બાયડ પોલીસ તેમજ ગણેશ યુવક મંડળ ના યુવકો નો સિંહ ફાળો રહ્યો હતો. આ ગણેશ ચતુર્થીના ઉત્સવમાં જે લોકોએ ફાળો તેમજ સાથ સહકાર આપ્યો છે તે તમામનો બાયડ ગણેશ મંડળ ના જીગરભાઈ પટેલ, રવિભાઈ પટેલ, ધાર્મિકભાઈ પટેલ, વિજયભાઈ પટેલ તેમજ દરેક સભ્યો એ આભાર માન્યો

શોભાચાત્રામાં ગજરાજ અને અખાડાના કરતબો આકર્ષણનું डेन्द्र रह्या

બિરાજમાન કરાયા રથની આજુબાજુ બાઉન્સરો ની સિક્ચુરિટી સૂથે ભારત બેન્ડ ના ગીતો, નાસીક ઢોલના તાલે, અખાડા કરતબો, જગજ્ઞાથ મંદિર - અમદાવાદના ગજરાજ સાથે ભગવાન ગણેશજી નગરયાત્રાએ નીકળ્યા હતા. આ શોભાયાત્રા લગભગ ૩૦૦૦ થી ૪૦૦૦

કોરલ લેબોરેટરીઝ લિમિટેડ **૨૪૪. ઓફિસ**્ર: એસએફ-૨૦૬, સીલ્વર ઓક કોમ્પલેક્ષ,

બી.પી.સી. રોડ, વડોદરા-ગુજરાત-૩૯૦૦૨૦ **કોર્પોરેટ ઓફિસ** : ૩/બી, પાટણવાલા કંપાઉન્ડ, શ્રેયસ સીનેમા સામે, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ, મહારાષ્ટ્ર -૪૦૦ ૦૮૬ ટે. ૦૨૨-૨૫૦૦૫૨૪૫ Email: cs@corallab.com website: www.corallab.com CIN: L24231GJ1997PLC031669

૪૦મી વાર્ષિક જનરલ મીટિંગ અંગેની નોટીસ તથા રીમોટ ઈ-વોટિંગ અને બૂક ક્લોઝર સંબંધિત માહિતી

આથી સૂચના આપવામાં આવે છે કે કોરલ લેબોરેટરીઝ લિમિટેડ (કંપની)ની ૪૦મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)ગુરુવાર, ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ સવારે ૧૧.૦૦ વાગ્યે (IST) એસએફ-૨૦૬, સિલ્વર ઓક કોમ્પ્લેક્સ, બી.પી.સી. રોડ, વડોદરા, ગુજરાત ૩૯૦૦૨૦, ખાતે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ખાતે યોજાશે. એજીએમ બોલાવતી તારીખ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૨ની નોટિસમાં દર્શાવ્યા મુજબ વ્યવસાયનો

વ્યવહાર કરવા માટે યોજાશે. પ મે, ૨૦૨૦ ના સામાન્ય પરિપત્ર નંબર ૨૦/૨૦૨૦ અનુસાર, કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને C No. SEBI/HO/CFD/CMD1/CIR/P/૨૦૨૦/ ૭૯ તારીખ ૧૨ મે, ૨૦૨૦ ના રોજ, સિક્ચોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા જારી કરાયેલ. કંપનીએ ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થયેલા વર્ષ માટે ૪૦મી એજીએમ અને વાર્ષિક અહેવાલની નોટિસ, મંગળવાર, ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ ઈલેક્ટ્રોનિક મોડ દ્વારા તે સભ્યોને મોકલી છે જેમના ઈમેલ એડ્રેસ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ/લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સાથે નોંધાયેલા છે. (LIIPL). રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ. નોટિસ અને વાર્ષિક રિપોર્ટ મોકલવાની

પૂર્ણતાની તારીખ મંગળવાર, ૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ છે. વાર્ષિક સામાન્ય સભાની સૂચના કંપનીની વેબસાઇટ www.corallab.com અને BSE લિમિટેડની વેબસાઇટ એટલે કે www.bseindia.com પર ઉપલબ્ધ છે. અધિનિયમની કલમ ૯૧ની જોગવાઈઓને અનુસરીને તેના હેઠળ બનાવેલા નિયમો અને LODRના નિયમન ૪૨ સાથે, કંપનીના સભ્યોનું રજિસ્ટર અને ટ્રાન્સફર બુક શુક્રવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨થી ગુરુવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી બંધ રહેશે.

કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટેશન) નિયમો. ૨૦૧૪ના નિયમ ૨૦ સાથે વાંચેલા કાયદાની કલમ ૧૦૮ ની જોગવાઈઓ એનુસાર, કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૫ અને લિસ્ટિંગ રેગ્યુલેશન્સના નિયમન ૪૪ દ્વારા સુધારેલ છે, કંપની કૃપા કરીને સભ્યોને એનએસડીએલ દ્વારા પૂરી પાડવામાં આવેલ ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ પ્લેટફોર્મ (રિમોટ ઈ-વોટિંગ) દ્વારા એજીએમની સૂચનામાં નિર્ધારિત ઠરાવો પર મત આપવાના

તેમના અધિકારનો ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડવા માટે. મેસર્સ. સાર્ક એન્ડ એસોસિએટ્સ, કંપની સેક્રેટરીઓ, મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શક રીતે થાય તેની ખાતરી કરવા માટે રીમોટ ઇ-વોટિંગ અને એજીએમમાં મતદાનની ચકાસણી કરવા માટે સ્ક્રૂટિનાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

રિમોટ ઈ-વોટિંગનો સમયગાળો સોમવાર, ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨, સવારે ૯:૦૦ કલાકે (IST) શરૂ થાય છે અને બુધવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૨, સાંજે ૫:૦૦ ક્લાકે (IST) **સમાપ્ત થાય છે.** આ સમયગાળા દરમિયાન, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૨, એટલે કે કટ-ઓફ ડેટ, ગુરુવારે ભૌતિક અથવા ડીમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં શેર ધરાવતા સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે તેમનો મત આપી શકે છે. એનએસડીએલ દ્વારા ઈ-વોટિંગ મોડ્યુલને ત્યાં મતદાન કરવા માટે નિષ્ક્રિય કરવામાં આવશે. જે સભ્યો, કંપનીની રજિસ્ટર્ડ ઓફિસમાં એજીએમમાં શારીરિક રીતે હાજરી આપી રહ્યા છે, જેમણે રિમોટ ઈ-વોટિંગ દ્વારા ઠરાવો પર પોતાનો મત આપ્યો નથી અને અન્યથા તેઓને આમ કરવાથી રોકવામાં આવ્યા નથી, તેઓ સવારે ૧૧.૦૦ વાગ્યા(**IST**)થી મીટિંગમાં મતપત્ર દ્વારા મત આપવા માટે પાત્ર હશે. એજીએમના નિષ્કર્ષ સુધી. જે સભ્યોએ એજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો મત આપ્યો છે, તેઓ ભૌતિક એજીએમમાં હાજરી આપવા/ભાગ લેવા માટે લાયક હશે, પરંતુ સભામાં ફરીથી મતદાન કરવા માટે લાયક રહેશે નહીં. સભ્યોના મતદાન અધિકારો ગુરુવાર, સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૨ની કટ-ઓફ તારીખે કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીમાં તેમના દ્વારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હશે. કોઈપણ વ્યક્તિ જે સભ્ય છે. કટ-ઓફ તારીખે કંપની એજીએમની નોટિસ માટે નિર્ધારિત તમામ ઠરાવો પર ઈલેક્ટ્રોનિક રીતે મત આપવાને પાત્ર છે. ડીમટીરિયલાઈઝ્ડ મોડ, ફિઝિકલ મોડમાં શેર ધરાવતા સભ્યો અને જેમણે તેમના ઈમેલ એડ્રેસની નોંધણી કરાવી નથી તેમના દ્વારા એજીએમમાં રિમોટ ઈ-વોટિંગ અને બેલેટ કરવાની રીત ૪૦મી એજીએમની નોટિસમાં આપવામાં આવી છે.

ઈલેક્ટ્રોનિક માધ્યમથી મતદાન કરવાની સુવિધા સાથે જોડાયેલ કોઈપણ ફરિયાદના કિસ્સામાં સભ્યો પણ સંપર્ક કરી શકે છે.

નામઃ સુશ્રી સરિતા મોરે હોદ્દોઃ સહાયક મેનેજર ઇમેઇલઃ evoting@nsdl.co.in

ફોનઃ ૦૨૨-૨૪૯૯૪૭૩૮ ટોલ ફ્રી નંબરોઃ ૧૮૦૦ ૧૦૨૦ ૯૯૦ અને ૧૮૦૦ ૨૨૪૪૩૦

શેર ધારકોને નોટીસ રવાના કર્યાની તારીખ ૦૨જી, સપ્ટેમ્બર ૨૦૨૨ બાદ તથા ઉપર

સ્થળ : મુંબઈ

વારીખ : ૦૬,૦૯.૨૦૨૨

જણાવેલી કટ-ઓફ તારીખ સુધીમાં કંપનીના શેર મેળવનારા સભ્યો કંપનીને cs@corallab.com પર અથવા તો શેર ટ્રાન્સફર એજન્ટને ashok.sherugar@linkintime.co.in પર લેખિતમાં જાણ કરીને રીમોટ ઈ-વોટિંગ માટેની પોતાની લોગઈનની વિગતો મેળવી શકે છે.

> કોરલ લેબોરેટરીઝ લિમિટેડ વતી રુચિ અંજારિયા

કંપની સેક્રેટરી અને અનુપાલન અધિકારી

CIN: L65100GJ1984PLC082579 ૨જીસ્ટર્ડ ઓફીસ : ૨૨, પ્રથમમાળ, દરસિધ્ધ કોમ્પલેક્ષ સામે, VAPI Valsad GJ 396195 IN Corporate Office: 902-904,

આદેશ કર્યા છે.

કાલુપુર કોમેરીકલ બેન્ક, ઇન્કમ ટેક્સ, આશ્રમ રોડ, અમદાવાદ-380014 ગુજરાત. ઇ-મેઇલ આઇડી : <u>shivanshfinserve@gmail.com</u>

શિવાંશ ફ્રીનસર્વલીમીટેડ

વાર્ષિક સામાન્ય બેઠક, બુક ક્લોઝરની સુચના

આથી નોટીસ આપવામાં આવી છે કે શિવાંશ ફીનસર્વ લીમીટેડની વાર્ષિક સામાન્ય સભા ગુરૂવાર, ૨૯-સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૦૧:૦૦ કલાકે કંપનીની ૨૧૦૨૮ર્ડ ઓફીસમાં યોજાશે જેમાં સામાન્ય અને ખાસ ઠરાવ ઉક્ત બેઠકની સુચનામાં જણાવ્યા મુજબ પસાર કરવામાં

વાર્ષિક રીપોર્ટ અને એજીએમની સુચના : કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની લાગુ જોગવાઇ અને તેના હેઠળ બનાવેલા નિયમોનું પાલન કરીને, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેના વાર્ષિક અદેવાલ સાથે નોટીસ સભ્યોને મોકલવામાં આવી છે. વાર્ષિક અદેવાલ સાથે એજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.<u>shivanshfinserve.com</u> પર પણ ઉપલબ્ધ છે. જે સભ્યોને નોટીસ અને વાર્ષિક રિપોર્ટ મળ્યો નથી. તેઓ કંપનીની વેબસાઇટ પરથી આનો સંદર્ભ અથવા ડાઉનલોડ કરી શકે છે અથવા કંપનીને ઇમેઇલ ID:shivanshfinserve@gmail.com અથવા કંપનીની રજીસ્ટર્ડ ઓફીસ પર પણ લખીને તેની સોફટ કોપી માટે વિનંતી કરી શકે છે.

બુક કલોઝરની અવધિની સૂચનાઃ કંપનીના (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ સાથે વાંચેલા કંપનીઝ એકટ, ૨૦૧૩ની કલમ ૯૧ મુજબ કંપની દ્વારા નોટીસ આપવામાં આવી છે કે ર૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભાના હેતુથી સભ્યોનું ૨જીસ્ટર અને કંપનીના શેર ટ્રાન્સફર બુક તારીખ ૨૨-૦૯-૨૦૨૨ થી ૨૯-૦૯-૨૦૨૨ (બંને દિવસોનો સમાવેશ) બંધ રહેશે.

શિવાંશ ફીનસર્વ લીમીટેડ એસડી/-નિર્દેશક ॐञ्जेश शाह डीनः ०२११२३४३

डानुन्गो इार्घनान्सर्स सीभीटेड CIN: L65100GJ1982PLC086450

૨જીસ્ટર્ડ ઓફીસ : બી/૭, 'બી' વીંગ, ૫ મો માળ, અજેતા વાણિજય કેન્દ્ર ઇન્ક્રમ ટેક્સ, આશ્રમ રોડ, અમદાવાદ-380009 ગુજરાત. ઇ-મેઇલ આઇડી : kanungofinanciers@gmail.com

વાર્ષિક સામાન્ય બેઠક, બુક ક્લોઝરની સુચના

આથી નોટીસ આપવામાં આવી છે કે કાનુન્ગો ફાઈનાન્સર્સ લીમીટેડની વાર્ષિક સામાન્ય સભા મંગળવાર, ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કંપનીની ૨જીસ્ટર્ડ ઓફીસમાં ચોજાશે જેમાં સામાન્ય અને ખાસ ઠરાવ ઉક્ત બેઠકની સુચનામાં જણાવ્યા મુજબ પસાર કરવામાં આવશે.

વાર્ષિક રીપોર્ટ અને એજીએમની સૂચના : કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની લાગુ જોગવાઇ અને તેના हेઠળ બનાવેલા નિયમોનું પાલન કરીને, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેના વાર્ષિક અહેવાલ સાથે નોટીસ સભ્યોને મોકલવામાં આવી છે. વાર્ષિક અદેવાલ સાથે એજીએમની સૂચના કંપનીની વેબસાઇટ www.kanungofinanciers.com પર પણ ઉપલબ્ધ છે. જે સભ્યોને નોટીસ અને વાર્ષિક રીપોર્ટ મળ્યો નથી. તેઓ કંપનીની વેબસાઇટ પરથી આનો સંદર્ભ અથવા ડાઉનલોડ કરી શકે છે અથવા કંપનીને ઇ-મેઇલ-ID : kanungofinanciers@gmail.com અથવા કંપનીની ૨જીસ્ટર્ડ ઓફીસ પર પણ લખીને તેની સોફ્ટ કોપી માટે વિનંતી કરી શકે છે.

બુક કલોઝરની અવધીની સુચના : કંપનીના (મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ સાથે વાંચેલા કંપનીઝ એક્ટ, ૨૦૧૩ ની કલમ ૯૧ મુજબ કંપની દ્વારા નોટીસ આપવામાં આવી છે કે ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ યોજાનારી કંપનીની વાર્ષિક સામાન્ય સભાના દેતુથી સભ્યોનું ૨જીસ્ટર અને કંપનીના શેર ટ્રાન્સફર બુક તારીખ ૨૦-૦૯-૨૦૨૨ થી ૨૭-૦૯-૨૦૨૨ (બંને દિવસોનો સમાવેશ) બંધ રહેશે.

કાનુન્ગો ફાઇનાન્સર્સ લીમીટેડ એસડી/-निर्देशङ ચિરાગ કિર્તીકુમાર શાહ डीन : ०८१११२८८

PARAMOUNT COSMETICS (INDIA) LIMITED

Registered Office: PLOT NO. 165/B-15 & 16, 2ND PHASE, GIDC 9th Floor, Prestige Meridian-1, No. 29, M.G. Road, Bangalore 560001 Corporate Identity Number: L24240GJ1985PLC008282;

Tel: 91 80 25320870/71 Email: compliance.officer@parammount.com; website: www.parammount.com

NOTICE is hereby given that the 37th Annual General Meeting "AGM") of the Company will be held on Friday, September 30, 2022 at 11.00 AM through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of AGM, which is being circulated for convening the AGM.

In view of the continuing COVID-19 pandemic, the Government of India, Ministry of Corporate Affairs, vide its Circular No. 14/ 2020, 17/2020, 20/2020, 02/20210 and 02/2022 dated 08th April, 2020, 13th April, 2020, 5th May, 2020, 13th January, 2021, 14th December, 2021 and 5th May, 2022 respectively issued by Ministry of Corporate Affairs (Collectively referred to as the "MCA Circulars") and also Securities Exchange Board of India, vide its circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/ 62 dated 13th May, 2022, the company has sent notice to all the of the 37th Annual general meeting along with Annual Report 2021-22 through electronic mode to all the members whose e-mail address are registered with the Company/

Registrar and Share Transfer Agent/Depositories In compliance with the provisions of Section 108 of the Companies Act. 2013 read with relevant rules thereunder and Regulation 44 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The company is pleased to provide its members the facility to exercise their right to Vote by electronic means at the 37th AGM (Remote E Voting) and the business to be transacted at the aforesaid AGM may be transacted through remote e voting services provided by Central Depository Services Limited (CDSL).

Notice is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made thereunder and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the register of Members and Share Transfer Book of the Company will remain closed from Saturday, 24th September, 2022 to Friday, 30th September, 2022(both days inclusive) for purpose of 37th Annual General Meeting.

The remote e-voting period will commence at 9.00 a.m. on Tuesday, 27th September 2022 and will end at 5.00 p.m. on Thursday, 29th September, 2022. The e-voting module shall be disabled by CDSL for voting thereafter

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date 23rd September, 2022 may cast their vote electronically on the Ordinary and Special Business as set out in the Notice of AGM through electronic voting system of CDSL from a place other than venue of AGM ("remote e-voting").

Any person, who is a Member of the Company as on September 23, 2022 ("Cutoff date") is eligible to caste vote on all the resolutions set forth in the Notice of AGM using Evoting or voting through Ballot Papers at the AGM.

A person who has acquired shares and become a member of the Company after the dispatch of notice of AGM and holding shares as of cutoff date, may cast their votes by following the instructions and process of remote e-voting as provided in the Notice of the AGM uploaded at our website www.parammount.com and CDSL website www.cdslindia.com.However, if the person is already registered with CDSL for remote Evoting then the existing user ID and password can be used for casting vote.

In case of any queries relating to voting by electronic means, please refer to the Frequently Asked Questions (FAQs) and evoting user manual for Shareholders available at the Help section of www.evotingindia.com or contact at toll free No. 1800-200-5533. In case of any grievances connected with facility for voting by electronic means, please contact Mr. Rakesh Dalvi, Manager, (CDSL,) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 1800225533.

Place : Bangalore Date : 24th Aug. 2022

By Order of the Board of Directors sd/- Hiitesh Topiiwaalla Managing Director